

રોકડા રૂપિયા ૨,૧૦,૦૦૦/- ચીલ ઝડપ કરનાર આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી,  
ગુનાનો ભેદ ઉકેલતી, સુરત શહેર કાર્થમ બ્રાંચ.

સુરત શહેરના લીમ્બાયત પો.સ્ટે. વિસ્તારમાં એક મોટર સાયકલ ઉપર સવાર બે અજાણ્યા ઈસમોએ મોટર સાયકલ ઉપર સવાર ફરીયાદીના ગળામાં ભેરવેલ રૂ.૨,૧૦૦૦/- વાળી બેગ આંચકી ચીલઝડપનો ગુનો બનાવા પામેલ તેમજ પો.સ્ટે. વિસ્તારમાં ચેઈન સ્નેચીંગ, મોબાઈલ સ્નેચીંગના તથા ચીલઝડપના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને આરોપીને પકડી પાડવા કાર્થમ બ્રાન્ચના પો.સ.ઈ. શ્રી એમ.એસ.ત્રિવેદી નાઓની ટીમ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો. મહાવીરસીંહ રણજીતસીંહ તથા અ.પો.કો. યોગેન્દ્રસીંહ દિલુભા નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઉન પાટીયા સના મીલની સામે જાહેર રોડ ઉપરથી આરોપી શાહરૂખ S/O ફારૂખ કમરૂદીન શેખ ઉ.વ. ૨૩ રહે, ૩૯, મુજ્જમીલ નગર, પ્રેરણા સ્કુલની સામે ઉન પાટીયા, સુરત શહેરનાને પકડી પાડી તેના પાસેથી રોકડ રૂપિયા ૪૫૦૦૦/- તથા વગર નંબરની કાળા કલરની બજાજ પલ્સર-૨૨૦ મો.સા. કિ.રૂ. ૧૦૦૦૦/-મળી કુલ્લે રૂ.૧૪૫૦૦/- ના મત્તાન મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને લીમ્બાયત પો.સ્ટે. પાર્ટ એ-૧૧૨૧૦૦૨૫૨૦૦૨૭૪૯.પી.કો. કલમ ૩૭૯(એ)૩, ૧૧૪ મુજબના વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ મજકુરની પુછપરછ કરતા તેના મિત્ર નરસીંહ ઉર્ફે પીન્ડુ રવજીભાઈ ખાણધર તથા સતીષ મોતીભાઈ વસાવા નાઓએ ભેગા મળી બનાવના દશ દિવસ પહેલા રોજે રોજ રૂપિયાનુ કલેકશન કરતા લોકોને શોધી તેને ટાર્ગેટ બનાવી તેના પાસેથી રૂપિયા કમાવવાનુ નક્કી કરેલ. આરોપી તથા નરસીંહ ઉર્ફે પીન્ડુ નાઓ વગર નંબરની પલ્સર મો.સા. ઉપર તથા સતીષ મોતીભાઈ વસાવાનો પોતાના પાસેની બજાજ એવેન્જર ઉપર સવાર થઈ દશ દિવસ સુધી લીમ્બાયત, ડીડોલી તથા ઉધના વિસ્તારમાં ફરી રેકી કરી રોજે રોજ રૂપિયાનુ કલેકશન કરતા ઈસમોની શોધખોળ કરતા હતા દરમ્યાન બનાવના દિવસે ફરીયાદી નાઓને આરોપી સતીષ વસાવા આસપાસ મંદિર પાસે આવેલ દેવનારાયણ કિરાણા સ્ટોર્સમાં રૂપિયા ગણતા જોઈ ગયેલ અને કિરાણા સ્ટોર્સ પરથી ફરીયાદી પોતાની મો.સા. ઉપર રૂપિયા લઈ નીકળતા આરોપી શાહરૂખ શેખ તથા નરસીંહ ઉર્ફે પીન્ડુ નાએ પલ્સર મો.સા. ઉપર ફરીયાદીનો પીછો કરી ઉપરોક્ત ગુનાનો અંજમ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે.